

મિડલ ઈસ્ટનો તણાવ શેરબજારમાં તેજીને રૂંધશે, સેન્સેક્સ-નિફ્ટી ઘટશે

મીડલ ઇસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ, કુડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને યુએસ કુગાવાના આંકડા તેમજ ફેડરલ રિઝર્વની આગામી ઓઠકમાં વ્યાજદર અંગેનો નિર્ણય શેરબજારમાં તોફાની વધઘટ લાવશે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે, ભારતીય શેરબજારમાં લાર્જકેપ શેરોમાં તથા હેવીવેઇટ શેરોમાં ભારે વધઘટ ચાલુ રહેશે, પણ મિડકેપ તથા સ્મોલકેપ શેરોમાં આગામી સપ્તાહમાં ઉછળાટ જોવા મળી શકે

નજર રહેશે, કેમ કે આ તણાવ રહે તો કુડ ઓઇલના ભાવ ઉપર અસર રહેશે. જે ભારતના કુગાવો વધારી શકે છે. વિશ્વને યુદ્ધ અને મોંઘવારીના ખખરમાં હોમી દેવાનો અને અમેરિકાને પણ પાચમાલ કરી દેવાનો જાણે ટૂંપે નિર્ધાર કર્યો હોય એમ ધરાનને હવે અફઘાનિસ્તાન બનાવી દેવા અમેરિકાએ શરૂ કરેલા અત્યંત ઘાતક હુમલાઓને ખેતી વિશ્વ અસાધારણ આર્થિક કટોકટીમાં ઘડેલાવાના સંકેત મળી રહ્યા છે. પશ્ચિમ એશિયાની



કરવા માંડ્યા છે. ભારત સહિતના દેશોને કુડ ઓઇલનો ભરુપર પુરવઠો પુરો પાડનાર રશિયા અને વેનેઝુએલાના ઓઇલ ભંડારો પર કબજો કરીને અને ધરાની ઘુંટણીએ લાવીને તેના ઓઇલ ભંડારો ઉપર કબજો કરવાનો બદધરાદો ધરાવતું અમેરિકા ખુદ ડિઝલના પુરવઠાની ખેંચનો સામનો કરવા માંડ્યું છે. જેના પરિણામો વિશ્વભરમાં ઈંદાણાના ભાવોમાં ભડકો થતા આ કટોકટીની પરિસ્થિતિના સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે. જે વૈશ્વિક બજારોના સેન્ટિમેન્ટને અત્યંત ખરાબ કરી શકે છે.

ભારતીય શેરબજારમાં 2026નું વર્ષ ડિફેન્સસેક્ટર માટે એક ઐતિહાસિક વર્ષાંક સાબિત થયું છે. આ સિવાય મેગા આઇપીઓ એનએસઇ અને જિયો પ્લેટફોર્મની ટેચારી છે. સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં એનએસઇનો આઇપીઓ બજારને હચમચાવશે. જોકે હાલમાં આઇપીઓ છલકાવી

દેવાના અને ઉચા પ્રીમિયમ સાથે લિસ્ટીંગ કરીને રિટેલ ઇન્વેસ્ટરોને સેકેન્ડરી બજારમાં શેરો ખરીદવા લલચાવવાની થઇ રહેલા પ્રયાસથી રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે. લિસ્ટીંગ ગેઇન અથવા લિસ્ટીંગના દિવસના ઉચા પ્રીમિયમનો લાભ લઇને રોકાણકારોએ હળવા થઇ જવું લાભદાયી રહેશે. આવનારા દિવસોમાં અનેક આઇપીઓ આવી રહ્યા છે, તેમાં આ રોકાણ કરવું. અત્યારે જે રીતે આઇપીઓનો રાફડો ફાટી નીકળ્યો છે તેને ખેતી હાર્દ મહેતાની તેજીનો સમય ચાદ આવી ગયો હતો, તે સમયે પણ ઇચ્છુઓનો રાફડો ફાટી નીકળ્યો હતો, તેવો જ ટ્રેડ્સ જોવા મળી રહ્યો હતો.

સેકેન્ડરી બજારમાં અત્યારે શેરોમાં નવી તેજીના મંડાણ થવાની પુરી શક્યતા છે, પરંતુ એફઆઇઆઇની વેચવાલી અટકે એ જરૂરી છે. આ ઉપરાંત, અલ નીનોની અસરને ખેતી દુકાણના ડાકલા ઘુંભા માંડ્યા હોઇ મોંઘવારીનું પરિબળ પણ જોખમી છે.

કુડ ઓઇલના ભાવમાં નવો ભડકો થવાના સંબેગોમાં ભારતની હાલત કફોડી બનવાની પણ પુરી શક્યતા છે. જેથી અત્યારે ટુંકાગાળે નફો ખાતા રહીને કેશ ઓન હેન્ડ રાખવું હિતાવહ રહેશે.

મિડકેપ અને સ્મોલકેપના પસંદગીના શેરો ઉપર ફોકસ વધારવું જોઈએ, આઇપીઓની વણઝાર આવી રહી છે, પણ રોકાણકારોએ લિસ્ટીંગ ગેઇન અથવા ટુંકાગાળાનો લાભ લઇને હળવા થતા રહેવું

છે. યુએસથી અપેક્ષિત કરતા વધુ સારા બેન્ચ ડેટા જોદે થયા છે, જેના લીધે મીડ સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વની બેઠક મળનારી છે. આ બેઠકમાં બદલાતી અપેક્ષાઓ પર નજર રાખશે. સ્થાનિક મોરચે ડીઆઇઆઇનું વલણ, રૂપિયાની ગતિશીલતા અને કુડ ઓઇલના ભાવો ઉપર બજારની નજર રહેશે. ખાસ કરીને હોમીનું સ્ટ્રેટ ઉપર ભારતની

કટોકટી, યુકેન અને રશિયાનું યુદ્ધ અને હવે અલનીનોના કારણે સર્જાયેલી કુદરતી આફતોએ દુનિયાભરમાં અજ્ઞ મોંઘવારીને સ્કોટક બનાવી દીધી હોઇ હવે આગામી સમયમાં અજ્ઞ માટે નવા યુદ્ધના મંડાણ થાય તો પણ નવાઇ નહીં પામશે. વિશ્વમાં અત્યારે જે દેશો તેમના ઓઇલ-ગેસના ભંડારો પર મુસ્તાક હતા, એ દેશો પણ ઈંદાણની કટોકટીનો સામનો



માર્કેટ વોચ

સુધારો જોવા મળી શકે છે. આ તમામ સેક્ટરમાં લાર્જકેપ શેરોની બદલ મિડકેપ અને સ્મોલકેપના પસંદગીના શેરોમાં જબરજસ્ત તેજી આવી શકે છે.

બીજી તરફ, પ્રાયમરી બજારમાં પણ આગામી સપ્તાહમાં આઇપીઓની વણઝાર આવી રહી છે. આ સિવાય મેગા આઇપીઓ એનએસઇ અને જિયો પ્લેટફોર્મની ટેચારી છે. સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં એનએસઇનો આઇપીઓ બજારને હચમચાવશે. જોકે હાલમાં આઇપીઓ છલકાવી

અલ નીનોની અસર, જળ વિદ્યુતનું ઉત્પાદન ઘટતા ભારતમાં વીજળીનું સંકટ સર્જશે

અલ નીનોની અસર કૃષિ ઉત્પાદન ઉપર જ સીમિત રહી નથી, પણ નબળા ચોમાસાના કારણે જળવિદ્યુત ઉત્પાદન ઉપર મોટી અસર થવા પામી છે. જળાશયો અને નદીઓના પાણીના નીચા સ્તરના કારણે જળવિદ્યુત ઉત્પાદન ઓછી થઈ રહી છે. એકબાજુ અલ નીનોના કારણે ચોમાસુ નબળુ પડ્યું છે અને તેથી ખેડૂતોને ખેતી માટે પાણીની જરૂરિયાત પુરી કરવા માટે વીજળીની માગ વધી રહી છે. બીજી તરફ, જળવિદ્યુત ઉત્પાદન ઘટી રહ્યું છે તેથી દેશમાં વીજ સંકટ તોળાઈ શકે તેવા અંધાણ વર્તાઈ રહ્યા છે. એક અહેવાલ અનુસાર ભારતમાં સતત ચોથા મહિને જળવિદ્યુત ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે.



જેટલો ઓછો થયો હતો. જેનું મુખ્ય કારણ અલ નીનોના લીધે હવામાનમાં ફેરફાર છે. સામાન્ય કરતા નબળા ચોમાસાના કારણે તાપમાનમાં પણ વધારો થયો છે. ખેડૂતો સિંચાઈ માટે વીજળીનો વપરાશ વધારી રહ્યા છે. જેના કારણે વીજ માગમાં પણ વૃદ્ધિ થઈ છે. જોકે, સૌર ઊર્જાના લીધે થોડીક માગમાં રાહત જોવા મળી રહી છે. આ વર્ષની શરૂઆતમાં, જળ વિદ્યુતની અછતને પહોંચી વળવા માટે સરકારે વરસાદની ઋતુ દરમ્યાન પણ કોલસા આધારિત મોટા પાવર પ્લાન્ટને કાર્યરત રાખવા માટે કટોકટીના નિયમો લંબાવવા પડ્યા હતા.



કરજ-રોષિક

જુન મહિનામાં જળવિદ્યુત ઉત્પાદનમાં સૌથી મોટો ઘટાડો જોવાયો હતો. જે 21 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. ફેબ્રુઆરી, 2024 પછી આ સૌથી મોટો ઘટાડો હતો. જુલાઈમાં વરસાદમાં સુધારો થયો હતો, પરંતુ ઓગસ્ટમાં ફરી નબળો પડ્યો હતો. જુનથી સપ્ટેમ્બર મહિના સુધીના સમયગાળા દરમ્યાન સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અત્યાર

સુધીની 14 ટકા અછતના કારણે જમીનની ભેજ અને જળાશયના પાણીના સ્તરમાં ઘટાડો થયો છે. આ વર્ષે હાઈડ્રોપાવરના ઉત્પાદનમાં ઘટાડો થવાનું એક કારણ એ છે કે ગત વર્ષ 2025માં ભારે વરસાદના કારણે બંધોમાંથી નોંધપાત્ર વીજ ઉત્પાદન થયું હતું. જે આ વર્ષે નબળા ચોમાસાના કારણે વીજ ઉત્પાદન પર અસર

આધારિત છે. તે મોટા જળાશયો કરતા નદીના કુદરતી પ્રવાહ પર આધાર રાખે છે. હિમાલયના પ્રોજેક્ટસ ઉનાળામાં બરફ પીગળવાથી લાભ મેળવે છે. જ્યારે અન્યત્ર બેસીન મોટાભાગે વરસાદ પર આધાર રાખે છે. જુલાઈ મહિનામાં થોડા સમય માટે વરસાદ ઓછો થયો હોવાથી ભારતનું હાઈડ્રોપાવર ઉત્પાદન

નબળા ચોમાસાના લીધે ખેડૂતો સિંચાઈ માટે વીજ માગમાં વૃદ્ધિની સામે ઓછું વીજ ઉત્પાદન સંકટ પેદા કરશે

પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં હાઈડ્રોપાવરનો હિસ્સો અંદાજે 11 ટકા છે. છેલ્લા દાયકામાં ભારતની હાઈડ્રો પાવર ક્ષમતામાં લગભગ પાંચમાં ભાગનો વધારો થયો છે. નવીનીકરણીય અને પરમાણુ ઊર્જા જેવા મુખ્ય સ્વચ્છ ઊર્જાસ્ત્રોતોમાં આ સૌથી ધીમી વૃદ્ધિ છે. દેશની 52 ગીગાવોટ ક્ષમતાનો મોટો હિસ્સો નદીના પ્રવાહ પર

દબાણ હેઠળ છે. આના કાણે ગ્રીડને ઉચી વીજળીની માગ વચ્ચે ઓછા હાઈડ્રોપાવર સપ્લાયનું સંચાલન કરવાની ફરજ પડી છે. આમ, નબળા ચોમાસાથી કૃષિ જગતને સૌથી વધુ અસર થઈ છે. જેઓને સિંચાઈ માટે વીજ માગમાં વધારો થશે. એકબાજુ ઓછું વીજ ઉત્પાદન અને બીજી તરફ વીજ માગમાં ઉછાળો આવનારા સમયમાં વીજ સંકટ ઉભી થવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી.

ભારત-ફ્રાન્સ ટેક્સટાઈલ અને ફેશન સહયોગ કરાર કાપડ ઉદ્યોગમાં નવી વૈશ્વિક તકો ઉભી કરશે

ભારત ટેક્સ ટ્રેડ ફેરેશન (BTTF) અને પ્રીમિયર વિઝન SA, સર્જનાત્મક ફેશન, કાપડ અને સોર્સિંગ માટે વિશ્વના અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૈકીના એક, એ 2 સપ્ટેમ્બર, 2026 ના રોજ પ્રીમિયર વિઝન (પેરિસ) પ્રદર્શનમાં વૈશ્વિક ફેશન અને કાપડ ઇકોસિસ્ટમ સાથે ભારતના જોડાણને મજબૂત બનાવવાના હેતુથી બહુ-વર્ષીય સંસ્થાકીય ભાગીદારી સ્થાપિત કરવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત-ફ્રાન્સ ટેક્સટાઈલ અને ફેશન સહયોગ કરાર કાપડ ઉદ્યોગમાં નવી વૈશ્વિક તકો ઉભી કરશે.આ વ્યૂહાત્મક એમઓયુ પ્રીમિયમ ફેશનમાં ભારતીય કાપડ ઉદ્યોગ માટે વૈશ્વિક તકો ઊભી કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારી, ભારતીય કાપડ ઉદ્યોગ ઉચ્ચ કક્ષાની વૈશ્વિક ફેશનમાં ગતિ મેળવશે.

સીઈઓ ફ્લોરેન્સ રૂસન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા . આ સમારોહમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના સચિવ નીલમ શમી રાવ અને વિકાસ કમિશનર (હેન્ડલૂમ) ડૉ. એમ. બીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ભારતના અગ્રણી ટેક્સટાઈલ ઉદ્યોગપતિઓ, અગ્રણી ડિઝાઈનર્સ, EPC અધિકારીઓ, ભારતીય દૂતાવાસના અધિકારીઓ, BTTF નેતૃત્વ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. આ MoU નો હેતુ ભારતીય

અને કારીગરોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો, ફેશન હાઉસ અને પ્રીમિયમ સોર્સિંગ નેટવર્ક્સ સાથે જોડાવા માટે એક મુખ્ય માર્ગ પૂરો પાડે છે.

મુખ્ય વ્યૂહાત્મક દિશ્ય ભારતને વોલ્યુમ-આધારિત નિકાસથી આગળ વધીને ઉચ્ચ-મૂલ્ય, ડિઝાઈન-આધારિત અને પ્રીમિયમ સેગમેન્ટ્સ તરફ લઈ જવાની સુવિધા આપવાનો છે. પ્રીમિયર વિઝનના ટ્રેન્ડ નેતૃત્વ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.

પ્રીમિયમ ફેશનમાં ભારતીય કાપડ ઉદ્યોગ માટે વૈશ્વિક તકો ઊભી કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારી, ભારતીય કાપડ ઉદ્યોગ ઉચ્ચ કક્ષાની વૈશ્વિક ફેશનમાં ગતિ મેળવશે

કાપડને વૈશ્વિક ફેશન ઇકોસિસ્ટમ સાથે જોડવાનો છે.પ્રીમિયર વિઝન પાંચ દાયકાથી વધુ સમયથી ફેશન ઉદ્યોગ માટે એક આંતરરાષ્ટ્રીય માપદંડ રહ્યું છે. આ ભાગીદારી ભારતીય કાપડ ઉત્પાદકો, નિકાસકારો, ડિઝાઈનર્સ

ઉચ્ચ-ગુણવત્તાવાળા સોર્સિંગ સોલ્યુશન્સ શોધતા ખરીદદારો સાથે સંબંધો બનાવવા માટે સમર્થન આપશે. જાન્યુઆરી 2026 માં ભારત- EU મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો પૂર્ણ થયા પછી આ



ભાગીદારી એક મહત્વપૂર્ણ તબક્કે આવી છે . આ કરારે ભારતની 99.5% નિકાસને અગ્રી લેતી 96.8% ટેરિફ લાઈન પર પસંદગીની બજાર એક્સેસ પ્રદાન કરી હતી, જેમાં વેપાર મૂલ્ય દ્વારા 90.7% નિકાસ અમલમાં આવ્યા પછી ડ્યુટી-મુક્ત થવાની અપેક્ષા છે.

કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર માટે, આ તક પાસ કરીને મહત્વપૂર્ણ છે. 2025 માં EU ની વૈશ્વિક કાપડ અને વસ્ત્રોની આયાત આશરે US\$292.8 બિલિયન હતી, જ્યારે ભારતની કાપડ અને

વસ્ત્રોની નિકાસ હાલમાં EU માં લગભગ US\$10.4 બિલિયન છે. તેથી, ભારત-EU FTA દ્વારા કાપડ અને કપડાંની ટેરિફ લાઈનમાં શૂન્ય-ડ્યુટી એક્સેસનો પ્રસ્તાવ ભારતીય નિકાસકારો માટે વસ્ત્રો, કાપડ, ચાન અને હોમ ટેક્સટાઈલમાં નોંધપાત્ર તકો ઊભી કરશે તેવી અપેક્ષા છે, જ્યારે યુરોપિયન બજારમાં ભારતની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે.

ભારત સરકારના કાપડ મંત્રાલયના સચિવ નીલમ શમી રાવે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર

જો તમે રૂ. બે કરોડના ભંડોળ સાથે નિવૃત્ત થઇ રહ્યા છો તો આટલું તમારે ધ્યાને લેવું જરૂરી છે



બે કરોડ રૂપિયા સાથે નિવૃત્તિ લેવી એ આશ્વાસન આપનારું લાગે છે, પરંતુ વાસ્તવિક પ્રશ્ન નિવૃત્તિ પછી શરૂ થાય છે: ભંડોળ વહેલું ખાલી કર્યા વિના તમે દર મહિને કેટલું ઉપાડી શકો છો? તેનો કોઈ એક જ જવાબ નથી કારણ કે પરિણામ નિવૃત્તિ સમયે તમારી ઉંમર, ખર્ચની જરૂરિયાતો, રોકાણ મિશ્રણ, કુગાવો, કર અને પૈસા કેટલા સમય સુધી ટકી રહેવાની જરૂર છે તેના પર આધાર રાખે છે. તાજેતરના નિવૃત્તિ માર્ગદર્શિકામાં પણ ભાર મૂકવામાં આવ્યો છે કે ઉપાડ દર ફક્ત આયોજનનો પ્રારંભિક બિંદુ છે, ગેરંટી નહીં.

એક સરળ ઉદાહરણ તરીકે, 2 કરોડ રૂપિયામાંથી 3 ટકા વાર્ષિક ઉપાડથી વાર્ષિક આશરે 6 લાખ



વેલ્થ ક્રિએશન

રૂપિયા અથવા શરૂઆતમાં દર મહિને 50,000 રૂપિયા મળશે. 4 ટકાના દરે, પ્રથમ વર્ષનો ઉપાડ વધીને આશરે 8 લાખ રૂપિયા અથવા દર મહિને 66,667 રૂપિયા થશે. 5 ટકા ઉપાડનો અર્થ દર મહિને લગભગ 83,333 રૂપિયા થશે, જ્યારે 6 ટકા ઉપાડથી 1 લાખ રૂપિયા મળશે. જોકે, ઉપાડ જેટલો વધારે હશે, લાંબા નિવૃત્તિ દરમિયાન ભંડોળ પર દબાણ એટલું જ વધારે હશે. તાજેતરના ભારતીય નિવૃત્તિ વિશ્લેષણ સૂચવે છે કે લાંબા ગાળાના ટકાઉપણું ઇચ્છના વ્યક્તિ માટે 3 ટકાથી 4 ટકા શરૂઆતી ઉપાડ વધુ સાવચેતીભર્યું હોઈ શકે છે. IIM અમદાવાદ દ્વારા ચર્ચા કરાયેલા એક ભારતીય અભ્યાસમાં દલીલ કરવામાં આવી છે કે યુએસ બજારના અનુભવમાંથી વિદ્યાર્થીઓમાં આવેલ વ્યાપકપણે ટાંકવામાં આવેલ 4 ટકાનો નિયમ ભારત માટે ખૂબ આકર્ષક હોઈ શકે છે અને કુગાવા, બજારની

અસ્થિરતા અને ઉપલબ્ધ નિવૃત્તિ ઉત્પાદનોમાં તફાવતને કારણે 3 ટકાથી 3.5 ટકા વધુ યોગ્ય હોઈ શકે છે. વાર્ષિક સરેરાશ 5 ટકા કમાણી કરવા માટે 2 કરોડ રૂપિયાના ભંડોળનું રોકાણ ધ્યાનમાં લો, જેમાં ઉપાડ સતત રહે છે. 8 ટકા ઉપાડ દર, અથવા લગભગ રૂ. 1.33 લાખ પ્રતિ મહિને, એક ઉદાહરણરૂપ ગણતરી સૂચવે છે કે ભંડોળ લગભગ 18 વર્ષમાં ખતમ થઈ શકે છે. 6 ટકા, અથવા રૂ. 1 લાખ પ્રતિ મહિને, તે સમાન ધારણાઓ હેઠળ લગભગ 32 વર્ષ સુધી ટકી શકે છે. આ ગેરંટીકૃત પરિણામો

નિવૃત્તિ ઉપાડ ઉંમર, ખર્ચ, કુગાવા પર આધાર રાખે છે, બે કરોડ રૂપિયાનું નિવૃત્તિ ભંડોળ માસિક આવક પૂરી પાડી શકે છે, પરંતુ તમે કેટલી રકમ ઉપાડી છો, કુગાવો અને રોકાણનું વળતર નક્કી કરશે કે પૈસા ખરેખર કેટલા સમય સુધી ટકી રહે છે. વળી તેમાં ભારતનો 4% નિયમ ખૂબ આકર્ષક હોઈ શકે છે

નથી કારણ કે વાસ્તવિક વળતર વધઘટ થાય છે અને બજારની મંદી દરમિયાન કરવામાં આવેલા ઉપાડ પરિણામને નોંધપાત્ર રીતે બદલી શકે છે. નિવૃત્ત લોકો ઘણીવાર કુગાવાનો આંકડો ઓછો આંકે છે. જો તમારા પરિવારને આજે દર મહિને રૂ. ૭૦,૦૦૦ ની જરૂર હોય, તો તે રકમ ૧૫ કે ૨૦ વર્ષ પછી સમાન માલસામાનની ખરીદી કરશે નહીં. ઉંમર સાથે આરોગ્ય સંભાળ ખર્ચ પણ વધુ નોંધપાત્ર બની શકે છે. એટલા માટે સમયાંતરે ખર્ચ અને રોકાણોની સમીક્ષા કર્યા વિના નિશ્ચિત રકમ ઉપાડવાથી ખરીદ શક્તિ ધીમે ધીમે ઘટી શકે છે, ભલે નજીવી ભંડોળ સ્વચ્છ દેખાય.

રોકાણ વ્યૂહરચના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સંપૂર્ણ રૂ. 2 કરોડ

ભાગ લાંબા ગાળાના વિકાસ માટે રોકાણ કરવો. ચોક્કસ ફાળવણી તમારી ઉંમર, જોખમ સહનશીલતા, અન્ય આવક અને નાણાકીય જવાબદારીઓને પ્રતિબિંબિત કરવી જોઈએ. પેન્શન આવક, ભાડાની આવક અથવા અન્ય ગેરંટીકૃત રોકડ પ્રવાહ પણ 2 કરોડ રૂપિયાના ભંડોળમાંથી ઉપાડવાની જરૂર પડતી રકમ ઘટાડી શકે છે. RBI ના તાજેતરના ડેટા દર્શાવે છે કે ઓગસ્ટ 2026 માં એક વર્ષથી વધુ સમય માટે બેંક ટર્મ-ડિપોઝીટ દર લગભગ 6 ટકાથી 6.75 ટકા હતા, જે દર્શાવે છે કે નિવૃત્ત લોકોએ ફક્ત એવું માનીને કે ફિક્સડ ડિપોઝીટ અનિશ્ચિત સમય માટે પૂરતી આવક ઉત્પન્ન કરશે તેના બદલે 6 પછીના વળતરની તુલના કેમ કરવી જોઈએ.